

**B.Ed. Semester - 2 (CBCS) Examination**  
**March/April -2019 (Old Course)**  
**ELEMENTS OF ACCOUNT (SELF STUDY COURSE)**

**Time: 1:15 Hours****Marks: 35****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 નીચેના પ્રત્યેક પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો.

(08)

- (1) ભૂલ સુધારણા એટલે શું?
- (2) ઘસારાનો અર્થ આપો.
- (3) અનામતનો અર્થ આપો.
- (4) હૂંડીનો અર્થ આપો.

પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ચારના જવાબ આપો.

(12)

- (1) સિદ્ધાંતની ભૂલ ઉદાહરણ સાથે સમજાવો.
- (2) ઘસારો નક્કી કરવાની કોઈ પણ છ પદ્ધતિના માત્ર નામ આપો.
- (3) સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચે તફાવતના ત્રણ મુદ્દા આપો.
- (4) બિન વેપારી સંસ્થાનો અર્થ અને તેના લક્ષણો સ્પષ્ટ કરો.
- (5) કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના લક્ષણો જણાવો.

પ્રશ્ન-3 નીચે પૈકી કોઈ પણ ત્રણના ઉત્તર આપો.

(15)

- (1) હૂંડી અને વચનચિઠ્ઠી વચ્ચે તફાવતના પાંચ મુદ્દા આપો.
- (2) નફા-નુકસાન ખાતાનો નમુનો આપો.
- (3) વ્યવહારની બેવડી અસરનો ખ્યાલ વિગતે સ્પષ્ટ કરો.
- (4) દેશી નામ પદ્ધતિના લક્ષણો સ્પષ્ટ કરો.
- (5) એક્નોધી નામા પદ્ધતિ અને દ્વિનોધી નામા પદ્ધતિ વચ્ચે તફાવત આપો.

\*\*\*\*\*

**ENGLISH VERSION**

Que-1 Give answers the following in brief. (08)

- (1) What is rectification of errors?
- (2) Give meaning of depreciation.
- (3) Give meaning of reserve.
- (4) Give meaning of bill of exchange.

Que-2 Answer any four from the following. (12)

- (1) Explain error of principle with example.
- (2) Name any six method for calculate depreciation.
- (3) Give three differences between general reserve and provisions.
- (4) Explain meaning and characteristics of non-trading concerns.
- (5) Mention characteristics of computer accounting.

Que-3 Answer any three from the following. (15)

- (1) Give five differences between bill of exchange and promissory note.
- (2) Give specimen of profit and loss account.
- (3) Explain dual aspect concept in detail.
- (4) Explain characteristics of deshi nama system.
- (5) Give differences between single entry system and double entry system.

\*\*\*\*\*